

ઘરને સુંદરતા અને શુભત્વ આપતી વસ્તુઓથી સુશોભન

હોમ ડેકોર - શ્વેતા પંચાલ

મોટા ભાગના લોકોની ઇચ્છા એવી હોય છે કે ઘરના ઇન્ટીરિયરમાં એવી એક્સેસરીઝનો ઉપયોગ કરવામાં આવે જે ઘરને રિચ લુક આપવાની સાથે ઘર માટે શુભ પણ બની રહે. આ માટે ચાઇનીઝ વિજ્ઞાન પર આધારિત ફેંગશૂઈની અનેક સુશોભિત વસ્તુ બજારમાં મળે છે , જે ઘરના સુશોભનની સાથે ઘરના માહોલને સકારાત્મક ઊર્જાથી ભરી દે છે. ફેંગશૂઈની વિવિધ એક્સેસરીઝ પર નજર કરીએ



લાઈંગ બુદ્ધા સંપત્તિના દેવતા છે. લાઈંગ બુદ્ધાની મૂર્તિને ઘરના મુખ્ય દ્વારની સામે રાખો , જેથી ઘરમાં પ્રવેશ કરતાંની સાથે જ તેનો ચહેરો દેખાય. લાઈંગ બુદ્ધામાં મૂર્તિ , ક્રિસ્ટલ, ઘાતુ અને ટેરાકોટા એમ જુદા જુદા મટીરિયલમાં મળે છે. લાઈંગ બુદ્ધામાં મૂર્તિ સિવાય પિક્ચર અને વોલપીસને પણ પ્રીફર કરી શકો છો. જે લાઇટ કલરની દીવાલ હોય તો તેના પર ડાર્ક કલરનું લાઈંગ બુદ્ધાનું વોલપીસ ક્લાસિક લુક આપે છે.

ફેંગશૂઈ એક્સેસરીઝમાં વેલ્થ વાઝ પણ ખાસ છે. વેલ્થ વાઝ પોર્સેલિન , ચાઇના વૂડનના મટીરિયલમાં મળે છે. જે વાઝ ફેંગશૂઈની દષ્ટિએ લેતા હો તો પારદર્શી વાઝ પસંદ ન કરવો. વેલ્થ વાઝનો શેપ કલાત્મક હોવાથી ઘરના લિવિંગ રૂમ , બેડરૂમમાં શો પીસ તરીકે ઉપયોગ કરી શકાય છે. ડાર્ક કલરની ડિઝાઇન વાઝને આકર્ષક લુક આપે છે.

વિન્ડ ચાઇમ ઘરમાં સૌભાગ્ય લાવે છે. હવાની તરંગમાં વહેતી તેની ધ્વનિ એનર્જીને એક્ટિવેટ કરે છે. વિન્ડ ચાઇમને ઘરના ઇન્ટીરિયર મુજબ પસંદ કરો. જે ઘરને પ્રાકૃતિક ટચ આપવા માગતા હો તો માટીની વિન્ડ ચાઇમ પસંદ કરો. ઘરના ઇન્ટીરિયરમાં વૂડનનો ઉપયોગ થયો હોય તો વૂડનની વિન્ડ ચાઇમ પસંદ કરી શકાય. આકર્ષિત રંગોમાં ક્રિસ્ટલની વિન્ડ ચાઇમ મધુર ધ્વનિ સાથે ઘરના માહોલને સકારાત્મક ઊર્જાથી ભરી દે છે.

સુખી મેરિડ લાઇફ માટે લવબર્ડનો ઉપયોગ કરી શકાય. લવબર્ડમાં બતકનું પિક્ચર અથવા ઘાતુ , ક્રિસ્ટલનાં બનેલાં બર્ડનાં સ્ટેચ્યુનો ઉપયોગ કરાય છે. લવબર્ડને બેડરૂમના ખૂણામાં કોર્નર ટેબલ પર મૂકી શકાય. જે લવબર્ડનું પેન્ટિંગ હોય તો તે બેડરૂમમાં બેડની સામેની દીવાલ પર લગાવો . ક્રિસ્ટલ લવબર્ડનાં સ્ટેચ્યુ બેડરૂમને ટ્રેન્ડી લુક આપે છે.